

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૦૨/૨૦૧૮ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૭૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૫ કેસ કરી, ૩૬ વ્યક્તિઓને ઝડપી, ૨૨૯૫ લીટર દેશી દારૂ, ૫૪ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૬,૯૪૬ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧ છોટાહાથી અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૮ કેસ કરી ૨૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૯,૪૦૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૭૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૧૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૩૭૮/૧૮

પાલડી: તૃપ્તિબહેન વા/ઓ દિપકભાઈ શાહ (ઉ.વ.૫૫) (રહે. આકાશદીપ ડુપ્લેક્ષ શ્રેયશટેકરા આંબાવાડી) એ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૨/૧૮ કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે પાલડી શ્રેયશબ્રીજ નીચે આયોજનનગરના ગેટ નંબર-૩ નજીક ત્રણ પુરૂષોએ પોલીસ તરીકે ઓળખ આપી તૃપ્તિબહેને પહેરેલ સોનાની બંગડી નંગ-૨ કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- પાકીટમાં મુકવાનું કહી નજર ચુકવી લઈ પલાયન થઈ ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરચર ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૩૭૯/૧૮

આનંદનગર: ગીરીશ ધનરાજભાઈ શર્મા (ઉ.વ.૪૨) (રહે. રોયલ શોલીટેયર રેજન્સી પ્લાઝા પાછળ પ્રેરણાતીર્થ રોડ આનંદનગર) એ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૦૨/૧૮ બપોરના ૩/૩૦ થી ૩/૪૦ વાગ્યા દરમિયાન ટીવીએસ ચાર રસ્તાથી વસ્ત્રાપુર ફાટક તરફ જવાના રોડ ઉપર આર.જે.પી હાઉસના ચાર રસ્તા ઉપર સાઈ કોર્નર પાન પાર્લર આગળ ગીરીશ શર્માની નજર ચુકવી અજાણી વ્યક્તિ કારમાંથી બેગની ચોરી કરી લઈ ગઈ હતી. બેગમાં આઈપેડ,મોબાઈલ ફોન, ડોંગલ, હાઈડ્રાઈવ અને રોકડ રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩,૧૭,૫૦૦/- મતા હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી.જાદવ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૩૮૦/૧૮

મેઘાણીનગર: રમેશચંદ્ર મુળજીભાઈ પરમાર (રહે. યુવાનનગર સોસાયટી વિભાગ-૪ ભાર્ગવ રોડ મેઘાણીનગર) એ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા.૨૩/૦૨/૧૮ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે મેઝો બ્રીજ ઉતરતા રામેશ્વર નજીકથી પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ રમેશચંદ્રના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.દેસાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૩૮૧/૧૮

ખોખરા: હરીશભાઈ ઉર્ફે હસમુખભાઈ મકવાણા (ઉ.વ.૫૧) (રહે. જય જગદીશ એપાર્ટમેન્ટ મ્યુ. બગીચા સામે ખોખરા) ચારેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોઈ તા.૨૩/૦૨/૧૮ બપોરના ૩/૩૦ વાગ્યા પહેલા પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.બી.પરમાર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.